

ત્વરિત જાહેરાત માટે

## ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં વૈશ્વિક જોડાણોને બળ પ્રદાન કરવા માટે સિટી ઓફ બ્રમ્પટન ભાગીદારી કરે છે NASSCOM સાથે

બ્રમ્પટન, ઓન્ટારિયો (05 મે 2022) – વિકસતા ઈનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્ર જે વૈશ્વિક વ્યવસાયો માટે અવસરોથી ભરચક છે તેની સાથે સિટી ઓફ બ્રમ્પટન ઈરાદાપૂર્વક અને નોંધપાત્ર પરિવર્તન આણવાની તૈયારીમાં છે. આજે સિટીએ નેશનલ અસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસિસ કંપનીઝ (NASSCOM) ઓફ ઈન્ડિયા સાથે બ્રમ્પટન ખાતે *લોન્ચપેડ પ્રોગ્રામ* પ્રસ્થાપિત કરવા માટે એક સમજૂતી પત્ર (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર સહી કરી. આ પ્રોગ્રામના વિસ્તરણ માટેના એકમાત્ર કેનેડિયન શહેર તરીકે બ્રમ્પટનને પસંદ કરવામાં આવ્યું છે.

આ ભાગીદારીના માધ્યમથી *લોન્ચપેડ પ્રોગ્રામ* ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) કંપનીઓના વૈશ્વિક વિસ્તાર માટે ઉત્પ્રેરકનું કાર્ય કરશે. કારણકે તેનાથી ભારત સરકાર અને સ્થાનિક ટેકનોલોજી ઈકોસિસ્ટમો વચ્ચેના જોડાણો વધશે. આ પ્રોગ્રામના સહભાગીઓને સરકારી નિયમોમાં સમર્થન મળવા સાથે, ટેક્સ પ્લાનિંગ અને વિવિધ પ્રદેશોમાં પ્રોન્સાહનો સાથે વિદેશી માર્કેટોમાં કાર્ય કરવાનું વધુ સુલભ બનશે.

દ [Brampton B Hive](#) – ડાઉનટાઉન બ્રમ્પટનમાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયો માટેનું એક સોફ્ટ લેન્ડિંગ પેડ – પ્રોગ્રામમાં ભાગ લેતી IT કંપનીઓ માટે હોમ બેઝનું કાર્ય કરશે.

### નેશનલ અસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસિસ કંપનીઝ (NASSCOM)

ભારતીય તેમજ બહુરાષ્ટ્રીય સંસ્થાઓ જેઓ ભારતમાં પણ કામ કરતી હોય તે સહિત 3,000 કરતા વધુ સભ્ય કંપનીઓથી NASSCOM બનેલું છે જે ભારતના ટેકનોલોજી ઉદ્યોગના ચેમ્બર ઓફ કોમર્સની એક અગ્રણી વેપાર સંસ્થા છે. તેની સદસ્યતા સ્ટાર્ટ-અપ્સથી લઈને બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ઉત્પાદોથી લઈને સેવાઓ સુધી અને, વૈશ્વિક સેવા કેન્દ્રોથી લઈને એન્જિનિયરિંગ કંપનીઓ સુધીના ઉદ્યોગના સમગ્ર સ્પેક્ટ્રમમાં ફેલાયેલી છે.

### બ્રમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિશે

[ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ](#), ડાઉનટાઉન બ્રમ્પટનમાં સ્થિત છે, જેનું ધ્યાન સ્ટાર્ટ અપ વિકાસ, નિવેશને આકર્ષવા પર કેન્દ્રિત છે અને તે સાહસિકો અને નવા વ્યવસાયોને સ્થાનિક સમર્થન પ્રદાન કરે છે. તે ઈનોવેશન અને ટેકનોલોજીની કંપનીઓને પોતાનું કામ આગળના ચરણ પર લઈ જવા માટે સંસાધનો પૂરા પાડે છે.

2019થી કરાર બનવાના શરૂ થયા તે અન્યાર સુધીમાં સિટીએ તેના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં \$20.5 મિલિયન જેટલી માતબર રકમ રોકવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તે ઉપરાંત ઈનોવેશન ભાગીદારો પાસેથી આશરે \$55.2 મિલિયન જેટલું રોકાણ થઈ રહ્યું છે.

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટના ભાગીદારોમાં સમાવેશ થાય છે ઉદ્યોગસાહસિકતા, વ્યાપાર વિકાસ, પોસ્ટ-સેકન્ડરી તાલીમ અને એક્સલેરેટર સ્પેસ જેમકે બ્રેમ્પટન આંત્રપ્રુન્યોર સેંટર, બીહાઈવ બ્રેમ્પટન (BHive Brampton), ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીની આગેવાનીમાં વેન્યર ઝોન, અલ્ટિટ્યુડ એક્સલેરેટર, ફાઉન્ડર ઈન્સ્ટિટ્યુટ, અલગોમા યુનિવર્સિટી અને રોજર્સ સાયબરસિક્સોર કેટેલિસ્ટ મુખ્ય મથક અને એક્સલેરેટર. શેરિડન એજ (Sheridan Edge), ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ ઊભું કરવા માટે બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ અને ડાઉનટાઉન બ્રેમ્પટન BIA પણ મહત્વપૂર્ણ ભાગીદારો છે.

### બ્રેમ્પટન બીહાઈવ (Bhive) વિશે

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં સ્થિત બીહાઈવ (BHive) સીટી ઓફ બ્રેમ્પટનની એવી પહેલ છે જેનું લક્ષ્ય નવપ્રવર્તકો એટલેકે ઈનોવેટરોની આગલી પેઢીનું સશક્તિકરણ કરવાનું છે, જે તેમની યાત્રાને ગતિ આપશે અને સાહસિક માટે તેમજ એકંદરે અર્થતંત્ર અને સમાજ માટે સકારાત્મક પ્રભાવ ઊભો કરશે. તે ટોરોન્ટો બિઝનેસ ડેવેલપમેન્ટ સેંટર (Toronto Business Development Centre)ના સહયોગથી પ્રસ્થાપિત થયું છે, બીહાઈવ (Bhive) વિદેશી ઉદ્યમીઓને આકર્ષવા માટે અભિપ્રેત છે જેમની કેનેડામાં નવા, અને પરિમાણ વધારવાની સંભાવના ધરાવતા વ્યવસાયો સ્ટાર્ટ-અપ વિઝા પ્રોગ્રામના માધ્યમથી સ્થાપવાની ઈચ્છા રાખતા હોય. સફળ અરજદારોને પરમેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે અને તેમના 6-માસના ઈન્ક્યુબેશન પ્રોગ્રામ દરમિયાન સંસાધનોની આખી શ્રેણી પ્રદાન કરાશે જેમકે ઓફિસની જગ્યા, નેટવર્ક કરવાની તકો તેમજ વ્યાપાર સમર્થન સેવાઓ.

સિટીના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિશે વધુ જાણકારી મેળવવા માટે, અહીં મુલાકાત

લો [www.bramptoninnovationdistrict.com](http://www.bramptoninnovationdistrict.com) અથવા સિટીનો [વિડિયો](http://www.brampton.ca) જુઓ જે આ ઈનોવેશન ઈકોસિસ્ટમના પ્રભાવો પર પ્રકાશ ફેંકે છે. બીહાઈવ (Bhive) વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં મુલાકાત લો [thehive.ca](http://thehive.ca).

### સુવાક્યો

"આ આખી મુદત દરમિયાન બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બ્રેમ્પટનનો વિકાસ ઈનોવેશનમાં અને રોકાણ માટેના મહત્વના સ્થળ તરીકે ઊભું કરવા માટે પોતાની પ્રાથમિકતા રાખી છે. NASSCOM જેવા આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે સંબંધો મજબૂત કરીને અમે વૈશ્વિક ધોરણે સ્થાનિક ધોરણે આર્થિક લાભ આપીને બ્રેમ્પટનની પ્રોફાઈલ ઉન્નત કરવાનું ચાલુ રાખ્યું છે. અમારા ભાગીદારો સાથે આ મહત્વનું કાર્ય કરતા રહેવા માટે હું ઉત્સુક છું!"

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિસ્સાધારકો સાથે સતત સહયોગ દ્વારા, બ્રેમ્પટન ઇનોવેશન ડિસ્ટ્રિક્ટની સ્થિતિ અનુપમ છે એમ કહી શકાય જ્યાં તેઓ એવી સેવાઓ અને સંસાધનોને વધુ ને વધુ સુલભ બનાવે છે જેથી સ્થાનિક સાહસિકો અને વ્યવસાયો વિકસી શકે. આ ભાગીદારી અમે અત્યાર સુધી કરેલા કાર્યોને ગતિ આપશે જેથી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં ઇનોવેશન અને ઉદ્યમની ઇકોસિસ્ટમ ઊભી થઈ શકે.

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4; પ્રમુખ, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રેમ્પટન.

"આપણે હવે જ્યારે ફરી બધું પ્રારંભ કરી રહ્યા છીએ તેવા કાળમાં સિટીને NASSCOMના પ્રતિનિધિ મંડળને આવકારતા ખૂબ આનંદ થયો હતો જેમાં આપણા વિકસી રહેલા ઇનોવેશન ડિસ્ટ્રિક્ટના મહત્વપૂર્ણ ભાગીદારો સાથે મુલાકાતીઓનો પરિચય કરાવી શક્યા હતા. ચાલુ રહેલા રોકાણ અને સહયોગના માધ્યમથી અમે બ્રેમ્પટનને ઇનોવેશનના વૈશ્વિક અગ્રણી તરીકે આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવાનું ચાલુ રાખી શક્યા છીએ.

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; ઉપ પ્રમુખ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, સીટી ઓફ બ્રેમ્પટન

"NASSCOM જેવા ભાગીદારો સાથે ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ પોતાની ઇકોસિસ્ટમનો વિકાસ કરવો ચાલુ રાખી શક્યા છે જેમાં ઇનોવેશન અને ટેકનોલોજી સાથે જોડાયેલા વ્યવસાયોને તેઓ વિકસી શકે એવા ટૂલ્સ અને સંસાધનો પૂરા પાડ્યા છે. વૈશ્વિક ભાગીદારીઓ અને વહેંચાયેલ જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓનો લાભ લઈને બ્રેમ્પટન રોકાણ કરવા માટેના વ્યવસાયો માટે એક અપ્રતિમ ગંતવ્ય સ્થાન તરીકે પુરવાર થયું છે.

- ક્લેર બાર્નેટ, ડાયરેક્ટર, બ્રેમ્પટન ઇકોનોમિક ડેવલપમેન્ટ, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):



## Media Release

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)